

કતારગામ પો.સ્ટે.ની અઢી મહિના પહેલાની રૂ.૪.૩૬ લાખના એમ્બ્રોઇડરી પાર્ટસ ચોરીના

આરોપીને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાંચ.

સુરત શહેર વિસ્તારમાં બનેલ 'અ', પડત ગુનાઓ શોધી કાઢવા માટે શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન હે.કો.હરપાલસીંહ જશુભા તથા હે.કો.હરીસીંહ વિરસંગભાઇ નાઓને મળેલ બાતમી હકીકત આધારે કતારગામ પો.સ્ટે.૧- ગુ.ર.નં.૨૦૩/૨૦૧૯ ઇ.પી.કો.કલમ ૩૮૦,૪૫૭,૧૧૪ મુજબના ગુનાના કામના આરોપી રૂપક કુસુમભાઇ વોડા, ઉ.વ.૨૩, રહે,૪૨,વૃંદાવન સોસાયટી, મિત્ર અશોક ઉડિયા સાથે ભાડાના મકાનમાં, મહાકાલ પાનના ગલ્લાની બાજુમાં, આસપાસ, ડીડોલી, સુરત મુળ રહે-આસામ વાળાને ડીડોલી વિસ્તારમાંથી ઝડપી પાડેલ, આરોપી છેલ્લા ત્રણ વર્ષથી તેના વતન જઇ શકેલ ન હોય જેથી આજથી અઢી મહિના પહેલા આરોપીના વતનમાંથી તેની માતા અને બહેનોના ફોન આવતા હતા અને તેને વતન બોલાવતા હતા પરંતુ તેની પાસે રૂપિયા ન હોય, જેથી તેણે તેના એક મિત્ર મુસાફીર પાસે રૂપિયાની માંગણી કરતા મુસાફીરે જણાવેલ કે, મારી પાસે પણ પૈસા નથી પરંતુ હું અગાઉ કતારગામ જુની જી.આઇ.ડી.સી.માં ખાતા નંબર-પી/૨૧૭ માં કામ કરતો હતો તે ખાતુ હાલમાં બંધ છે અને આપણે રાત્રીના આ ખાતાના તાળા તોડીને એમ્બ્રોઇડરી મશીનના પાર્ટસ ચોરી લાવીશુ અને જે રૂપિયા મળશે તે આપણે સરખે હિસ્સે વહેંચી લઇશુ એ રીતે પ્લાન બનાવીને રાત્રીના સુમારે મુસાફીરની એકટીવા ઉપર બેસી બંને જણા ગયેલ અને ઘડેલ પ્લાન મુજબ એમ્બ્રોઇડરી ખાતાના તાળા તોડી એમ્બ્રોઇડરી મશીનના કોડીંગ ડીવાઇસ, કોડીંગ કાર્ડ, માસ્ટર કાર્ડ વિગેરે છુટા પાડી ચોરી કરેલ દરમ્યાન ખાતામાં લાગેલ સી.સી.ટી.વી. કેમેરા પર નજર પડતા ડી.વી.આર.પણ ચોરી કરી કુલ્લે રૂ.૪,૩૬,૦૦૦/-ના મત્તાની ચોરી કરેલ એમ્બ્રોઇડરી ના ચોરેલ તમામ પાર્ટસ સહ આરોપી મુસાફીર વેચવા માટે લઇ ગયેલ તે બાદ તેનો મોબાઇલ ફોન બંધ થઇ જતા હાલના પકડાયેલ આરોપીને થયેલ કે, મુસાફીરને પોલીસે પકડી લીધેલ હશે અને હું પણ પકડાઇ જઇશ તેમ માની તે તાત્કાલીક બીજા જ દિવસે તેના વતન આસામ મુકામે નાશી ગયેલ હતો અને ગુનાને ઘણો સમય થયેલ હોય જેથી તેને કોઇ ડર ન રહેતા આજથી પાંચ છ દિવસ પહેલા સુરત મુકામે આવેલો હતો તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી પાડેલ છે.

આરોપીનો પુર્વ ઇતિહાસ:-(૧)સંદેર પો.સ્ટે.૧-ગુ.ર.નં.૨૫૫/૨૦૧૮ ઇ.પી.કો.કલમ ૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯, ૩૦૭, ૩૨૩ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ.(૨)કતારગામ પો.સ્ટે.૧-ગુ.ર.નં.૨૯૧/૨૦૧૮ ઇ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦,૧૧૪ (૩) કાપોદ્રા પો.સ્ટે.૧-૩૧૬/૨૦૧૮ ઇ.પી.કો.કલમ ૩૯૭, ૪૫૨ મુજબના ગુનાઓમાં પકડાય ચુકેલ છે.